https://archive.org/details/bk1036/page/n0/mode/1up

1955-05-05 -Sant Odhavrams letter to Ratanshi Khimji (1036)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

ૐ

RKK-689

તા. ૫-૫-૫૫

રતનશી ભાઈ નો જિજ્ઞાસુ દરબાર થી લી. સાધુ-
ઓધવરામના શુભાશિષ વાંચશો

ચિં. ભા. તમારો પત્ર મળ્યો છે વાંચી વિગત જાણી છે
અને જરૂર. પુષ્કળ આરામ. કરશો એવી મને ખાત્રી છે
મેં આપના નામનો આશરે ૧૫-૨૦- રૂપિયા ખર્ચ કરી-
અનુષ્ઠાન. કરવાનો કરી લીધું છે
અને સાથે સાથે આપને મારી-
ઈચ્છા પ્રમાણે રૂ. ૧૦૦૦) નો ખર્ચ દરબારમાં કરાવીશ તેવો
દ્રઢ સંકલ્પ. મનમાં ધારણ કરી લીધો શરીર ઉપરાંત.
કાંઈ નથી તેમ. ખુબ. દાનો કર્યો છે

હું જાઉં જાણું છું અને-
હજુ પણ કરશો મને ભરોસો છે કે આપને આરામ-
થઈ જશે હું ગુજરાત. ઉદ્ધાર. માટે જઈશ પણ હજુ તેમનો
કાંઈ નક્કી પણ નથી. આવવાથી. નક્કી થશે

અને ગુજરાત. પછી મુંબઈ
આવવાનો થશે દિવસ ૧૫-૨૦. મુંબઈમાં રહેવાનું
થશે મુંબઈ થી જે મારો સંકલ્પ છે તે આપને લખીશ
ખાતરી. આપ હિમ્મત માં રહેજો આપનું આયુષ્ય મારા-
હિસાબે હજુ ઘણું છે પછી તો સર્વજ્ઞ ઈશ્વર છે

પણ ભગત વલ્લભ છે ભગતો-
નું જરૂર સાંભળે છે. જેથી મેં પ્રભુ પાસે [illegible] આપ-
આપના માટે કરી છે.

realpatidar.com

https://archive.org/details/bk1036/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1036/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:24:10 +05'30'

realpatidar.com

ૐ

તા. ૫-૫-૫૫

RKK-689

રતનસીં ભાઈ નીં વિદ્યાકુ ઉદ્ધાર થી લીં. સાધુ-
ઉધ્ધવદાસના સુભાશિષ વાંચશો

ચિં. ભા. તમારા પત્ર પોંતા છે વાંચી વિગત જાણી છે
અને જરૂર. પ્રભુ આરામ. કરશે એવી મને ખાત્રી છે
મેં આપનાં નામનો આશરે ૧૫-૨૦- રૂપિયા ખર્ચ કરી -
અનુષ્ઠાન. કરવાનો કરી લીધું છે

અને સાથે સાથે આપને મારી-
ઈચ્છા પ્રમાણે રૂ. ૧૦૦૦) નોં ખર્ચ ઉદ્ધારમાં કરાવીશ તેવા
દ્રઢ સંકલ્પ. મનમાં ધારણ, કરી લેશો શરીર ઉપરાન્ત.
કાંઈ નથી તેમ. ખુબ. દાનો કર્યો છે

હું જેઠુંય જાણું છું અને -
હજુ પણ કરશો એવો ભરોસો છે કે આપન બીરાતાં-
થઈ જશે હું ગુજરાતં. ઉદ્ધાર. માટે જઈશ પણ હજુ તેના
કાંઈ નક્કી પણ નથી. આવવાથી. નક્કી થશે

અને ગુજરાત. પછી મુંબઈ
આવવાના જઈશ દિવસ ૧૫-૨૦. મુંબઈમાં રહેવાનું
થશે મુંબઈ થી જ મારા સંકલ્પ છે તે આપને લખીશ
ખાતરી. આપ હિંમત માં રહેજો આપનું આયુષ્ય મારા-
હિસાબે હજુ ઘણું છે પછી તો સર્વજ્ઞ ઈશ્વર છે

પણ ભાગ્ય બળવાન છે ભાગ્ય-
નું જરૂર સાંભળો. જેથી મેં પ્રભુ પાસે ··આવે -
આપનાં માટે કરી છે.

realpatidar.com

realpatidar.com

RKK-690

તે જરૂર. પ્રભુ સાંભળશે આપ જેવા. જ્ઞાતિ હિતેચ્છુ
પરોપકારી હજુ દુનીયાંમાં ઘણો કાળ. રહે તેમાં જુવો છે
કલ્યાણ છે નાના બાળકો ના પુન્ય પ્રતાપે જરૂર આપની
આયુષ્ય વધશે બસ. એજ.

ત્યાં સર્વે ને હરિહર કેહશો
અને હું મુંબઈ માં ~~[illegible]~~ હરીદાસ. શેઠ ના બંગલામાં
ઉતરીસ..

કરીશ ગંગાબાઈ રતનદાસ નાં હરિહર વાંચશો

દા. મોહન ના હરિહર વાંચશો
પૂં. મહારાજ શ્રી જી ને કહેવાથી.

Sant Odhavram

realpatidar.com